



નોનફાર્મ ધિરાણ ફ્લોટિંગ / ફિક્સ વ્યાજદરોમાં કરવામાં આવેલ ફેરફાર અંગે.

બેંક તરફથી નોનફાર્મ યોજના અન્વયે નીચે મુજબના ધિરાણ કરવામાં આવે છે. આ ધિરાણોના ફ્લોટિંગ / ફિક્સ વ્યાજ દરો જે-તે યોજના અનુસાર નીચે જણાવ્યા અનુસાર અમલમાં આવશે.

અ. નં.	ધિરાણનો પ્રકાર	ધિરાણની મર્યાદા	Revised ૦૭/૦૨/૨૦૨૫થી ફ્લોટિંગ નવો વ્યાજદર	Revised ૦૭/૦૨/૨૦૨૫થી ફિક્સ નવો વ્યાજદર	માસિક હપ્તા (મહત્તમ મર્યાદા)	માર્જિનના ટકા
#1	#2	#3			#5	#6
(૧)	(૧)મકાન બાંધકામ/ખરીદી (શહેર) તથા ઓડા ગુડા વિસ્તાર રહેણાંક⇨ (૨)મકાન બાંધકામ/ખરીદી (તાલુકા) રહેણાંક⇨ (૩)મકાન બાંધકામ/ખરીદી (ગ્રામ્ય) રહેણાંક⇨	૭૫,૦૦,૦૦૦ ૩૦,૦૦,૦૦૦ ૧૦,૦૦,૦૦૦	** ૮.૨૦% થી ૧૦.૦૦%	** ૮.૦૦% થી ૮.૮૦%	૨૪૦ હપ્તે	૧૫ થી ૨૫%
(૨)	(A) કાર લોન (અંગત વપરાશ) (B) ઈલેક્ટ્રીક કાર લોન(અંગત વપરાશ) (ખાનગી)	૬૦,૦૦,૦૦૦	** ૮.૨૦% થી ૧૦.૦૦%	** ૮.૨૫% થી ૧૦.૨૫%	૮૪ હપ્તે	૨૫%
	(C) ભાડાના વાહન— સી.એન.જી. રીક્ષા ફોર વ્હીલર નાના વાહનો/મોટા વાહનો⇨	૧,૦૦,૦૦૦ ૬૦,૦૦,૦૦૦	— ** ૧૦.૦૦% થી ૧૩.૦૦%	— ૧૧.૦૦% થી ૧૩.૦૦%	૪૮ હપ્તે ૮૪ હપ્તે	૧૦% ૩૦%
	(D) ટુ-વ્હીલર લોન (હેડઓફિસ ખાતે)	૧૦,૦૦,૦૦૦ સુધી	** ૮.૫૦% થી ૧૧.૦૦%	** ૧૧.૦૦% થી ૧૨.૦૦%	૬૦ હપ્તે	૩૦%
	(E)ઓલ્ડ કાર (વેલ્યુએશન મુજબ) મહત્તમ પાંચ વર્ષ સુધીની ખરીદેલ કાર પર	૫,૦૦,૦૦૦ સુધી	૧૪.૫૦% થી ૧૫.૫૦%	૧૧.૦૦% થી ૧૨.૦૦%	૬૦ હપ્તે	૫૦%
(૩)	સિક્યોરિટી લોન:— <u>ધંધાના પુરાવા + મિલકતમોર્ગેજ</u> ગ્રામ્ય વિસ્તાર ⇨ તાલુકા વિસ્તાર⇨ (ઓડા તથા ગુડા)	૧૦,૦૦,૦૦૦ ૧૫,૦૦,૦૦૦ ૩૦,૦૦,૦૦૦	** ૮.૦૦% થી ૧૧.૫૦%	** ૧૦.૫૦% થી ૧૧.૫૦%	૧૨૦ હપ્તે ૧૨૦ હપ્તે ૧૮૦ હપ્તે	વેલ્યુએશનનાં ૬૦%
	<u>ખેડૂતો તથા નોકરીયાત વર્ગ માટે (મિલકતમોર્ગેજ)</u> નોંધ ::— ખાસ સંજોગોમાં રૂ.૧૫/-લાખ સુધીનું ધિરાણ કરી શકાશે.	૧૦,૦૦,૦૦૦	** ૮.૦૦% થી ૧૧.૫૦%	** ૧૦.૫૦% થી ૧૧.૫૦%	૧૨૦ હપ્તે	વેલ્યુએશનનાં ૬૦%
(૪)	(A) એડીસી વેપાર સાથી (ટર્મલોન) પ્લાન્ટ / મશીનરી / ફર્નિચર / ઈકવીપમેન્ટ	પ્રોપરાયટરશીપ,પાર્ટનરશીપ ફર્મ, તથા વ્યક્તિગત જેમાં (ફક્ત ડોક્ટર,વકીલ,CA તથા પોફેશનલ) માટે તથા LLP માટે <u>૬૦/- લાખ સુધી</u> પબ્લીક લી. / પ્રાઈવેટ લી. રજી.ટ્રસ્ટ કું. (Incorporate Body) રૂ૨/- કરોડ સુધી	* ૮.૦૦% થી ૧૧.૦૦% .	* ૧૧.૦૦% થી ૧૨.૦૦% .	ટર્મલોન ૩૬ થી ૮૪ માસ માટે	૩૦% માર્જિન
	ધંધાકીય મિલકત ખરીદવા (સ્થાવર મિલકતના કિસ્સામાં ગ્રામ્ય વિસ્તારમાં રૂ૧૦/-લાખની મર્યાદા રહેશે)				સ્થાવર મિલકત માટે ૨૪૦ માસ	૨૦% માર્જિન સ્થાવર મિલકત
	(B) એડીસી વેપાર સાથી કેશક્રેડિટ વર્કિંગ કેપીટલ	પ્રોપરાયટરશીપ,પાર્ટનરશીપ ફર્મ, તથા વ્યક્તિગત જેમાં (ફક્ત ડોક્ટર,વકીલ,CA તથા પોફેશનલ) માટે તથા LLP માટે <u>૬૦/- લાખ સુધી</u> પબ્લીક લી. / પ્રાઈવેટ લી. રજી.ટ્રસ્ટ કું. (Incorporate Body) રૂ૨/- કરોડ સુધી	૧૦.૫૦% થી ૧૨.૦૦% .	૧૧.૦૦% થી ૧૨.૦૦%	કેશક્રેડિટ ૧૨ માસ માટે રિવ્યૂ તથા રિન્યુઅલ માટે હે.ઓ. ખાતે મોકલવી.	* અરજી ફોર્મના પાના નં: ૧૭ મુજબ ગણતરી બાદના સ્ટોકના ૭૫% અથવા *વાર્ષિક ટર્નઓવરના ૩૦% અથવા વેલ્યુએશનના ૮૦%
(૫)	ઉચ્ચ શિક્ષણ	૨૫,૦૦,૦૦૦	૮.૬૫% થી ૮.૬૫% .	૧૦.૦૦% થી ૧૧.૦૦% .	અભ્યાસના સમય પછી ૭ વર્ષ	ફી ના ૨૦% માર્જિન તથા વેલ્યુએશનના ૨૦% માર્જિન

(પાના નંબર :: ૨ પાછળ...)



અ. નં.	ધિરાણનો પ્રકાર	ધિરાણની મર્યાદા	Revised ૦૭/૦૨/૨૦૨૫થી ફ્લોટિંગ નવો વ્યાજદર	Revised ૦૭/૦૨/૨૦૨૫થી ફિક્સ નવો વ્યાજદર	માસિક હપ્તા (મહત્તમ મર્યાદા)	માર્જિનના ટકા
(૬)	એડીસી ટ્રેડર્સ ઓવર ડ્રાફ્ટ (મિલકતમોર્ગેજ સામે) નોંધ ::- ખાસ સંજોગોમાં રૂ.૧૫/-લાખ સુધી આપી શકાશે.	૧૦,૦૦,૦૦૦	* ૧૦.૫૦% થી ૧૨.૦૦% .	* ૧૧.૦૦% થી ૧૨.૦૦% .	૧૨ માસ માટે રિન્યૂ તથા રિન્યૂઅલ માટે હે.ઓ. ખાતે તમામ વિગતો સાથે મોકલવાની રહેશે.	* અરજી ફોર્મના પાના નં: ૧૪ મુજબ ગણતરી બાદના સ્ટોકના ૭૫% અથવા * વાર્ષિક ટર્નઓવરના ૩૦% અથવા વેલ્યુએશનના ૮૦%
(૭)	ધંધાકીય ઓવરડ્રાફ્ટ (મિલકત મોર્ગેજ સામે) (ઔડા તથા ગુડા સહિત) શહેરી વિસ્તાર⇒ તાલુકા વિસ્તાર ⇒ ગ્રામ્ય વિસ્તાર ⇒	૬૦,૦૦,૦૦૦ ૩૦,૦૦,૦૦૦ ૧૦,૦૦,૦૦૦	* ૧૦.૫૦% થી ૧૨.૦૦% .	* ૧૧.૦૦% થી ૧૨.૦૦% .	૧૨ માસ માટે રિન્યૂ તથા ૩૬ માસે રિન્યૂઅલ માટે હે.ઓ. ખાતે તમામ વિગતો સાથે મોકલવાની રહેશે.	માર્જિન ૪૦% વેલ્યુએશનના ૬૦% નોંધ : ઓ. ડ્રા. ની રકમનો માપદંડ બેંકની પોલિસી મુજબનો રહેશે.
(૮)	મકાન રિપેરીંગ:- રહેણાંક ⇒ કોમર્શિયલ ⇒	૮૮,૦૦૦ ૮૮,૦૦૦	--- ---	૧૦.૦૦% ૧૧.૦૦%	૮૪ હપ્તે ૮૪ હપ્તે	૨૫% ૨૫%
(૯)	(અ) ગવર્નમેન્ટ સ્પોન્સર સ્કીમ - બેન્કેબલ બાજપાઈ યુવા રોજગાર, - બાજપાઈ બેન્કેબલ યોજના શહેરી ટેક્ષી સેવા (CNG) - દત્તોપંત ટેંગડી કારીગર વ્યાજ સહાય યોજના તથા તમામ ગવર્નમેન્ટ સ્પોન્સર સ્કીમ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ સહાય યોજના ૧૦ મહિલાઓનું જુથ હોય તો જ (ઉમર વર્ષ ૧૮ થી ૬૦ વર્ષ સુધીની) (બ) - સેલ્ફ હેલ્પ ગ્રુપ - જોઈન્ટ લાયબીલીટી ગ્રુપ(JLG)	૧,૦૦,૦૦૦ ૫,૦૦,૦૦૦ ૧,૦૦,૦૦૦ ૧,૦૦,૦૦૦	--- --- --- ---	૧૧% ૧૧% ૧૧% ૧૨%	૬૦ હપ્તે ૬૦ હપ્તે ૬૦ હપ્તે ૩૬ હપ્તે	૨૫% (લેસ સબસીડી)
(૧૦)	ગૃહ વપરાશના સાધનો ખરીદવા	૮૮,૦૦૦	૧૦.૫૦% થી ૧૩.૦૦%	૧૨.૦૦% થી ૧૪.૦૦%	૬૦ હપ્તે	૨૫%
(૧૧)	જાત-જામીનગીરી લોન (પર્સનલ લોન):-	૮૮,૦૦૦	૧૦.૫૦% થી ૧૩.૦૦%	૧૨.૦૦% થી ૧૪.૦૦%	૬૦ માસ	
(૧૨)	રિઝર્વ બેન્ક રીલીફ બોન્ડ તથા એન.એસ.સી. અને કે.વી.પી. (શાખા લેવલે ૨ લાખ સુધી) (ઓવરડ્રાફ્ટ કે મુદતી ધિરાણ)	૧૦,૦૦,૦૦૦	---	૮%	બોન્ડના સમય મુજબ + પાકતી મુદત સુધી	૧૫% ૩૦%
(૧૩)	રહેણાંક ઉપર સોલાર પ્લાન્ટ નોખવા અને સ્વયંના વપરાશ કરવા માટે (DOMESTIC PURPOSE) સોલાર વોટરહીટર/સોલાર રૂફટોપ પેનલ લગાવવા	મહત્તમ મર્યાદા ૧૦,૦૦,૦૦૦	-	* ૮.૫૦% થી ૧૦% .	૮૪ માસ	૧૦% થી ૨૫%
(૧૪)	એ.ડી.સી. બેંક સરલ આત્મનિર્ભર યોજના	૮૮,૦૦૦	-	૮%	૩૬ માસ	૧% P/Fees

નોંધ ::-

- નોનફાર્મ ધિરાણના તમામ પ્રકારના ખાતામાં પ્રોસેસીંગ ચાર્જ ૦.૧૫% થી ૦.૩૫% લેખે વસૂલ કરવાનો રહેશે. (JLG/Govt. Sponsored schemeમાં પ્રોસેસીંગ ચાર્જીસ લાગુ પડશે નહીં)
- વાર્ષિક ઈન્સ્પેક્શન કરવું ફરજિયાત છે.
- કોષ્ટકના અનુક્રમ નંબર ::- ૪, ૬, ૭ માં રિન્યૂઅલ સમયે જે વ્યાજ દર હશે તે વ્યાજ દરથી રિન્યૂ કરવામાં આવશે.
- જે ખાતેદારોએ હાલમાં ફિક્સ વ્યાજદરે ધિરાણ મેળવેલ છે, તેઓને નવા ફ્લોટિંગ વ્યાજદર સ્વીકારવાનો વિકલ્પ આપી શકાશે.
- હાઉસીંગ લોનમાં લોનની મુદત પહેલા એટલે કે એડવાન્સ રીપેમેન્ટ એક વર્ષ દરમ્યાન બાકી રકમના ૨૫%થી વધુ ભરી શકાશે નહીં. હાઉસીંગ લોનના ખાતાઓ સિવાય લોન ખાતામાં લોનની મુદત પૂરી થતા પહેલા લોન સંપૂર્ણ ભરપાઈ થવાના કિસ્સામાં પરિપત્ર મુજબ કાર્યવાહી કરવી.
- લોન ખાતામાં ચેક રિટર્ન / ECS રિટર્ન ચાર્જ રૂ.૨૦૦/- + GST વસૂલવાનો રહેશે.
- ઓવરડ્રાફ્ટ રકમ ઉપર ૨% પેનલ્ટિ લેવાની રહેશે.
- ધંધાકીય હેતુસરના ધિરાણો પૈકી રૂ.૨૫,૦૦૦/-ની મંજૂર રકમ સુધીના ધિરાણોને સ્વ-રોજગાર ક્રેડિટ કાર્ડ (SCC) / જનરલ ક્રેડિટ કાર્ડ (GCC) અન્વયે ગણવાનું રહેશે.